

RAN-2108002602020001
M.Com. Part-II (External) Examination March - 2026
Financial Management
Time: 3 Hours]
[Total Marks: 100

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book	Seat No.: Student's Signature
---	--

- પ્ર.1. નીચેનાં પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. (20)**
1. આર્થિક ધીમાપન એટલે શું?
 2. હિત વિસંવાદિતા એટલે શું?
 3. લેણાં નિભાવવાના હેતુઓ જણાવો.
 4. કાર્યશીલ મૂડી સંચાલનનો અર્થ લખો.
 5. વિયોજનના સ્વરૂપો જણાવો.
 6. ઝીરો ઇન્ટરેસ્ટ બોન્ડ એટલે શું?
 7. વિન્ડો ડ્રેસિંગ એટલે શું?
 8. સમજાવો - બોનસ શેર
 9. વોરંટ સમજાવો.
 10. બુક બિલ્ડીંગ એટલે શું?
- પ્ર.2. (અ) ભારતીય નાણાંકીય તંત્ર વ્યવસ્થા સમજાવો (8)**
(બ) સંયોજન એટલે શું? તેના લાભાલાભની ચર્ચા કરો. (8)
અથવા
- પ્ર.2. (અ) વ્યાજ દર સ્વેપ ના પ્રકારો ની ચર્ચા કરો. (8)**
(બ) ડુ-પોન્ટ વિશ્લેષણ સમજાવો. (8)
- પ્ર.3. (અ) રીઝર્વ બેંક ના પ્રણાલિકાગત કાર્યો સમજાવો. (8)**
(બ) અદ્રશ્ય ઘનિષ્ઠ મિલકતો એટલે શું? તેના પ્રકારો ની ચર્ચા કરો. (8)
અથવા
- પ્ર.3. (અ) ભારતમાં કોર્પોરેટ ગવર્નન્સ ની વિગતવાર ચર્ચા કરો. (8)**
(બ) ખાનગી ભરણું એટલે શું? તેના લાભોની ચર્ચા કરો. (8)
- પ્ર.4. અમૈત્રીપૂર્ણ અંકુશ પ્રાપ્તિ એટલે શું? તેની સામેના સંરક્ષનાત્મક પગલાં ની ચર્ચા કરો. (16)**
અથવા
- પ્ર.4. જોખમ સંચાલન એટલે શું? તેની પ્રક્રિયા સમજાવો. (16)**

- પ્ર.5. (અ) લિવેરેજનો અર્થ જણાવી તેના પ્રકારોની ચર્ચા કરો. (8)
 (બ) નાણાંકીય સંચાલન પર કુગાવાની અસરો અને ઉપાયોની ચર્ચા કરો. (8)
- અથવા**
- પ્ર.5. (અ) સંયુક્ત સાલસ એટલે શું? તેના લાભાલાભની ચર્ચા કરો. (8)
 (બ) આર્થિક ધીમાપનની લાક્ષણિકતાઓ સમજાવો. (8)
- પ્ર.6. (અ) ટૂંકનોંધ લખો. (ગમે તે એક) (8)
 1. અબક વિશ્લેષણ ની પદ્ધતિ
 2. સ્વેપ્સનું વર્ગીકરણ
- પ્ર.6. (બ) કેસ સ્ટડી (8)
 રામ લી. એ પોતાના ગ્રાહક મેસર્સ સિયા લી. માટે કુલ શાખ મર્યાદા રૂ. 6,00,000/- નક્કી કરી છે. ખરીદીની વરદી દીઠ મર્યાદા રૂ. 200,000/- નક્કી કરી છે. 21 જાન્યુઆરી એ ગ્રાહકે રૂ. 2,50,000/- ની વરદી મૂડીને કંપનીને શાખ પર વેચાણ કરવા વિનંતી કરી છે. ઉપરોક્ત ગ્રાહક ને જોખમણા કયા વર્ગીકરણમાં મુકશો? એના માટે કેવી શાખ નીતિ અપનાવશો?

ENGLISH VERSION

- Q.1. Answer in brief (20)**
 1. What is Recession?
 2. What is Diversion of Interest?
 3. Write the motives of maintaining Receivables.
 4. Write the meaning of working capital management.
 5. State the forms of selloffs.
 6. What is zero interest bond?
 7. What is Window dressing?
 8. Explain Bonus Share
 9. What is Warrants?
 10. What is book building?
- Q.2. (A) Explain Indian Financial System. (8)**
(B) What is Merger? Discuss its merits and demerits. (8)
- OR**
- Q.2. (A) Discuss types of Interest Rate Swaps. (8)**
(B) Explain Du-Pont Analysis. (8)
- Q.3. (A) Explain Traditional Function of Reserve Bank of India. (8)**
(B) What are Intangible Intensive Assets. Discuss its types. (8)
- OR**
- Q.3. (A) Explain Corporate Governance in India. (8)**
(B) What is Private Placement? Discuss its advantages (8)
- Q.4. What is hostile takeover? Discuss its preventive measures of hostile takeover. (16)**
- OR**
- Q.4. What is risk management? Explain the process of risk management (16)**

- Q.5. (A)** Explain the meaning of leverage and discuss its types (8)
(B) Discuss the effects and remedies of Inflation on financial management (8)

OR

- Q.5. (A)** What is Joint Venture? Discuss its merits and demerits. (8)
(B) Explain the characteristics of recession. (8)

- Q.6. (A) Short notes (any one)** (8)
1. ABC analysis method of Inventory Control.
2. Categories of SWAPS.

- Q.6. (B) CaseStudy** (8)
Ram Ltd decided the credit limit of 600000 for its customer M/s SiyaLtd. Purchase Order Limit of Rs 200000 was decided on 21st January. Company placed the order of Rs 250000 and requested to sale on credit. How you will classify the customer according to risk? which type of Credit Policy will be accepted?
